



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૨/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૯ કેસ કરી, ૭૭ વ્યક્તિઓને ઝડપી, ૩૫૬ લીટર દેશી દારૂ, ૫૯ ઇંગ્લિશ દારૂ, ૧૨ બીયરટીન અને ૦૧ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૨,૨૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૩૭૩/૧૯

સરદારનગર : દેવાનંદભાઈ રતનલાલ મુલચંદાણી (ઉ.વ.૫૧)(રહે.ધન-લક્ષ્મી ફ્લેટ બંગ્લા એરીયા કુબેરનગર સરદારનગર) એ તા.૨૫/૦૨/૨૦૧૯ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૬/૧૮ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે નરોડા પાટીયા ભારતીય સ્ટેટ બેંક ના એ.ટી.એમ. ખાતે કોઈ અજાણી વ્યક્તિ દેવાનંદભાઈ ને વિશ્વાસમાં લઈ, એ.ટી.એમ.માંથી પૈસા કાઢવામાં મદદ કરવાના બહાને નજર ચુકવી એ.ટી.એમ.કાર્ડ બદલી લઈ રોકડ રૂપિયા ૭૯,૦૦૦/- મેળવી લઈ દેવાનંદભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.બ્રહ્મભટ્ટ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૩૭૪/૧૯

સોલા હાઇકોર્ટ : રેખાબહેન ડો/ઓ બચુભાઈ બારોટ (ઉ.વ.૫૧)(રહે.કુલવાડી, લુવાણા મહાજન વાડીની બાજુમા ભયાઉ તા.ભયાઉ જી.કચ્છ-ભુજ) તા.૨૫/૦૨/૨૦૧૯ બપોરના ૧૨/૦૦ થી ૧૨/૧૫ વાગ્યા દરમ્યાન ઇસ્કોન થી હેબતપુર ચાર રસ્તા ઝાંચડસ હોસ્પિટલ સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન ઓટોરીક્ષા ચાલક તથા પાછળ બેસેલ ત્રણ અજાણ્યા ઇસમો (૪૦ થી ૫૦ વર્ષના આશરાના) એ ભેગામળી રેખાબહેનની નજર ચુકવી તેમની બેગમાં રાખેલ પર્સ કે જેમા રહેલ સોનાનો દોરો કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-, સોનાની વીંટી કિંમત રૂપિયા ૮,૦૦૦/-, બંગડી તથા વીંટી કિંમત રૂપિયા ૧,૫૦૦/- તેમજ બીજા પર્સમા મુકેલ રોકડ રૂપિયા ૩,૫૦૦/- મળી કુલ રૂપિયા ૩૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગયા છે. આ અંગેની ફરીયાદ રેખાબહેન બારોટ એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એસ.સ્વામી ચલાવે છે.

રીવરફ્રન્ટ ઇસ્ટ : રામજીભાઈ નરસિંહભાઈ ચૌહાણ (ઉ.વ.૩૩)(રહે.શાહપુર ફાયર સ્ટેશન પાસે કમુમિયાની ચાલી નાગોરી કબ્રસ્તાન પાસે માધુપુરા)એ અગમ્ય કારણસર તા.૨૫/૦૨/૨૦૧૯ બપોરના ૩/૨૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે માસ્તર કોલોની પાસે સાબરમતી નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માતમોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મોતીભાઈ તળજાભાઈ ચલાવે છે.

નરોડા : કુશલ અમીત પરીખ (ઉ.વ.૩૨)(રહે.શાંતી આવાસ કો.ઓ.હો.સો બાલ્યા-૨ સુરાયા-૭ રોડ નાંદોળી શીલજ) એ અગમ્ય કારણસર તા.૨૫/૦૨/૨૦૧૯ સાંજના ૭/૫૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી મહેન્દ્રસિંહ માધુસિંહ ચલાવે છે.

કૃષ્ણનગર : ચાર્મી ધર્મેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૨૩)(રહે. ગેલેક્ષી રેસીડેન્સી મંગલમુર્તીની બાજુમા નરોડા) એ અગમ્ય કારણસર તા.૨૫/૦૨/૨૦૧૯ બપોરના ૧૨/૦૦ થી ૩/૦૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી આલુસિંહ દિપાજી ચલાવે છે.

કાગડાપીઠ : જસિંગભાઈ વાલજીભાઈ વાઘેલા(ઉ.વ.૪૨)(રહે,ઠાકોરલાલ પાસાવાળાની ચાલી જોગણી માતાના મંદિર પાસે ગીતામંદિર રોડ) એ પત્ની પિયરમાં જતા રહેલ તે વાતનું મનમા લાગી આવતા તા.૨૪/૦૨/૨૦૧૯ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નટવરભાઈ હરજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.